

શારીરિક ક્ષમતા અને કસોટીના માપદંડો

જગ્યાનું નામ:- વિભાગીય ફાયર અધિકારી

શારીરિક ક્ષમતા	<ol style="list-style-type: none">1. શારીરિક રીતે તંદુરસ્ત હોવા જોઈએ.2. લાલ.લીલો કલરના તફાવત જાણી શકતા હોવા જોઈએ.3. ઉંચાઈ પુરૂષો માટે તમામ ઉમેદવાર-૧૬૫ સે.મી. અને અનુસુચિત જન જાતિ ઉમેદવાર-૧૬૨ સે.મી., મહિલા માટે -તમામ ઉમેદવાર-૧૫૮ સે.મી. અને અનુસુચિત જન જાતિ ઉમેદવાર ૧૫૬ સે.મી.4. વજન પુરૂષો માટે ૫૦ કિગ્રા. લઘુતમ , મહિલા માટે ૪૦ કિલોગ્રામ લઘુતમ5. છાતી ::- સામાન્ય -૮૧ સે.મી. ફૂલાયેલી -૮૬ સે.મી. (ફક્ત પુરૂષ માટે)
શારીરિક કસોટી	<ol style="list-style-type: none">1. ૪૦૦ મીટરની સામાન્ય દોડ ૧૫૦ સેકન્ડમાં પૂર્ણ કરવાની રહેશે.2. તરણ ૧૦૦ મીટર ૩૦૦ સેકન્ડમાં પૂર્ણ કરવાની રહેશે.

શારીરિક ક્ષમતા અને કસોટીના માપદંડો

જગ્યાનું નામ:- સ્ટેશન ફાયર ઓફીસર

શારીરિક ક્ષમતા	<ol style="list-style-type: none">1. શારીરિક રીતે તંદુરસ્ત હોવા જોઈએ.2. લાલ.લીલો કલરના તફાવત જાણી શકતા હોવા જોઈએ.3. ઉંચાઈ પુરૂષો માટે તમામ ઉમેદવાર-૧.૬૫ સે.મી. અને અનુસુચિત જન જાતિ ઉમેદવારો-૧.૬૨ સે.મી., મહિલા માટે - તમામ ઉમેદવાર-૧.૫૮ સે.મી. અને અનુસુચિત જન જાતિ ઉમેદવાર ૧.૫૬ સે.મી.4. વજન પુરૂષો માટે ૫૦ કિગ્રા. લઘુતમ , મહિલા માટે ૪૦ કિલોગ્રામ લઘુતમ5. છાતી ::- સામાન્ય -૮૧ સે.મી. કૂલાયેલી -૮૬ સે.મી. (ફક્ત પુરૂષ માટે)
શારીરિક કસોટી	<ol style="list-style-type: none">1. હોઝ પાઈપ સાથેની વજન ઉચકીને ૫૦ મીટરની દોડ ૧૫ સેકન્ડમાં પૂર્ણ કરવાની રહેશે.2. ૪૦૦ મીટરની સામાન્ય દોડ-૧૫૦ સેકન્ડમાં પૂર્ણ કરવાની રહેશે.3. રસ્સો પકડીને ઉપર ચઢવાનું -૦૫ મીટર4. લાંબી કુદ -૩.૦૦ મીટર5. ઉંચી કુદ -૧.૦૦ મીટર6. તરણ ૧૦૦ મીટર -૩૦૦ સેકન્ડમાં પૂર્ણ કરવાની રહેશે.

શારિરીક ક્ષમતા અને કસોટીના માપદંડો

જગ્યાનું નામ:- લિડીંગ ફાયરમેન

શારિરીક ક્ષમતા	<ol style="list-style-type: none">1. શારિરીક રીતે તંદુરસ્ત હોવા જોઈએ.2. લાલ.લીલો કલરના તફાવત જાણી શકતા હોવા જોઈએ.3. ઉંચાઈ પુરૂષો માટે તમામ ઉમેદવાર-૧૬૫ સે.મી. અને અનુસુચિત જન જાતિ ઉમેદવાર-૧૬૨ સે.મી., મહિલા માટે -તમામ ઉમેદવાર-૧૫૮ સે.મી. અને અનુસુચિત જન જાતિ ઉમેદવાર ૧૫૬ સે.મી.4. વજન પુરૂષો માટે ૫૦ કિગ્રા. લઘુતમ , મહિલા માટે ૪૦ કિલોગ્રામ લઘુતમ5. છાતી ::- સામાન્ય -૮૧ સે.મી. કૂલાયેલી -૮૬ સે.મી. (ફક્ત પુરૂષ માટે)
શારિરીક કસોટી	<ol style="list-style-type: none">1. હોઝ પાઈપ સાથેની વજન ઉચકીને ૫૦ મીટરની દોડ ૧૫ સેકન્ડમાં પૂર્ણ કરવાની રહેશે.2. ૪૦૦ મીટરની સામાન્ય દોડ-૧૫૦ સેકન્ડમાં પૂર્ણ કરવાની રહેશે.3. રસ્સો પકડીને ઉપર ચઢવાનું -૦૫ મીટર]4. લાંબી કુદ -૩.૦૦ મીટર5. ઉંચી કુદ -૧.૦૦ મીટર6. તરણ ૧૦૦ મીટર -૩૦૦ સેકન્ડમાં પૂર્ણ કરવાની રહેશે.

શારીરિક ક્ષમતા અને કસોટીના માપદંડો

જગ્યાનું નામ:- કાયરમેન કમ ડ્રાઇવર

શારીરિક ક્ષમતા	<ol style="list-style-type: none">1. શારીરિક રીતે તંદુરસ્ત હોવા જોઈએ.2. લાલ.લીલો કલરના તફાવત જાણી શકતા હોવા જોઈએ.3. ઉંચાઈ પુરૂષો માટે તમામ ઉમેદવાર-૧૬૫ સે.મી. અને અનુસુચિત જન જાતિ ઉમેદવાર-૧૬૨ સે.મી., મહિલા માટે -તમામ ઉમેદવાર-૧૫૮ સે.મી. અને અનુસુચિત જન જાતિ ઉમેદવાર ૧૫૬ સે.મી.4. વજન પુરૂષો માટે ૫૦ કિગ્રા. લઘુતમ , મહિલા માટે ૪૦ કિલોગ્રામ લઘુતમ5. છાતી ::- સામાન્ય -૮૧ સે.મી. કૂલાયેલી -૮૬ સે.મી. (ફક્ત પુરૂષ માટે)
શારીરિક કસોટી	<ol style="list-style-type: none">1. હોઝ પાઈપ સાથેની વજન ઉચકીને ૫૦ મીટરની દોડ ૧૫ સેકન્ડમાં પૂર્ણ કરવાની રહેશે.2. ૪૦૦ મીટરની સામાન્ય દોડ-૧૫૦ સેકન્ડમાં પૂર્ણ કરવાની રહેશે.3. રસ્સો પકડીને ઉપર ચઢવાનું -૦૫ મીટર4. લાંબી કુદ -૩.૦૦ મીટર5. ઉંચી કુદ -૧.૦૦ મીટર6. તરણ ૧૦૦ મીટર -૩૦૦ સેકન્ડમાં પૂર્ણ કરવાની રહેશે.